

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૪/૧૧/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૯૦/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૪ કેસ કરી, ૬૪ વ્યક્તિઓને ઝડપી, ૨૧૬ લીટર દેશી દારૂ, ૫૪ બોટલ ઇંગ્લીશ દારૂ, ૬૦ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૨૦ બિયર ટીન, ૦૧ સ્કુટર, ૦૧ મોટર સાયકલ અને ૦૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૦૫ કેસ કરી ૦૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૫,૧૦૫/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૯૧/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૪૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૮૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડી અને વિશ્વાસઘાત :-

સમાચાર યાદી નં.૨૨૯૨/૧૭

વાસણા: પરમીત ડો/ઓ રાજેંદ્રસિંગ અરોરા (ઉ.વ.૩૯)(રહે,સ્ટર્લીંગ કો.ઓ.હા.સો. સુંદરવન કોમ્પ્લેક્સ લોખંડવાલા અંધેરી (વેસ્ટ) મુંબઈ મહારાષ્ટ્ર) એ તા.૧૩/૧૧/૧૭ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે છેલ્લા છ વર્ષથી આજદીન સુધીનાં સમયગાળા દરમ્યાન વાસણા બસ સ્ટેન્ડ પાસે, સંભવતિર્થ દેરાસર પાસે પ્રથમ મંગલ કોમ્પ્લેક્સખાતે આરોપી ઝાચેદ અકબરઅલી અન્સારી (રહે, ડાયમંડ એપાર્ટમેન્ટ ટાગોર હોલ પાછળ, એલીસબ્રીજ) એ પરમીત અરોરાને પોતાનું ખોટું નામ "રવી મારવાહ" જણાવી તેમજ પોતે દિલ્હીના રાજકારણીના પુત્ર હોવાનું જણાવી પરમીત અરોરાને વિશ્વાસમાં લઈ, તેની સાથે મિત્રતા કેળવી, રત્ન માણેકના ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાથી પરમીત અરોરાને લલચાવી ધંધામાં રોકાણ કરવા માટે ચેકથી અને રોકડા આશરે રૂપિયા ૩૦,૦૦,૦૦૦/- મેળવી લઈ આજદીન સુધી પરત નહી આપી, પરમીત અરોરા સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પો.સ.ઈ.પી.એચ.જાડેજા ચલાવે છે.

ઘરફોડ ચોરી:-

સમાચાર યાદી નં.૨૨૯૩/૧૭

સરદારનગર: હરેશભાઈ નારણભાઈ ખેમચંદાણી (રહે.સિંધુ સાગર સોસાયટી, માયા સિનેમા પાસે કુબેરનગર સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૧૧/૧૭ કલાક ૭/૪૫ વાગ્યાના સુમારે પોતાના મકાનની બાથરૂમની ગ્રીલ કાપી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૪,૯૫,૫૦૦/-, એચ.પી.કંપનીનું લેપટોપ અને મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૫૭,૦૦૦/- અને રોકડ રૂપિયા ૭,૧૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૨,૬૭,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એચ.બી.ઝાલા ચલાવે છે.

સોલા હાઇકોર્ટ: રાજેશભાઈ કાન્તીભાઈ ભટ્ટ (ઉ.વ.૩૦)(રહે,પેરેડાઈઝ પાર્ક બંગલો જી.ડી.પાર્ટી પ્લોટની સામે, સાયન્સ સીટી રોડ સોલા) એ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૩/૧૧/૧૭ રાતના ૧૧/૦૦ થી તા.૧૪/૧૧/૧૭ સવારના ૭/૦૦ વાગ્યા સુધીનાં સમયગાળા દરમ્યાન પોતાના મકાનના રસોડાની બારીની સ્ટોપર તોડી દરવાજો ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા ૭,૩૭,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૯૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વી.યુ.પાડવી ચલાવે છે

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૨૨૯૪/૧૭

નરોડા: રાજેશભાઈ લક્ષ્મીચંદ્ર ચાવલા (ઉ.વ.૩૭)(રહે.આર.ગ્રીન ફ્લેટ આઇ.ટી.આઇ.ની બાજુમા કુબેરનગર સરદારનગર) તા.૧૩/૧૧/૧૭ રાતના ૮/૩૦ વાગ્યાના સુમારે નરોડા બેઠકથી ગેલેક્સી સિનેમા રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, માખીજા શો રૂમની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ રાજેશભાઈના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ રાજેશભાઈ ચાવલાએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એમ.ઠાકોર ચલાવે છે.

ગાડીનો કાચ તોડી ચોરી:-

સમાચાર યાદી નં.૨૨૯૫/૧૭

ઇસનપુર: જીતેન્દ્રભાઈ ઇન્દ્રચંદ્ર બરડિયા (રહે.સ્નેહ સરિતા એપાર્ટમેન્ટ, પુષ્પકુંજ સોસાયટી કાંકરિયા મણીનગર) એ તા.૧૩/૧૧/૧૭ કલાક ૯/૧૫ વાગ્યાના સુમારે ઇસનપુર નીલકંઠ રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ સુમિત સેલ્સ એજન્સીની સામે પાર્ક કરેલ પોતાની ફોર વ્હીલ ગાડીના દરવાજાનો કાચ તોડી અજાણી વ્યક્તિ ગાડીમાંથી રોકડ રૂપિયા ૫૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ અંગેની ફરીયાદ જીતેન્દ્રભાઈ બરડિયાએ ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી વા.જી.માથુકિયા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.